



JAZ-16080002030305 Seat No. \_\_\_\_\_

## M. Com. (Sem. III) (CBCS) (W.E.F.-2016) Examination

December – 2019

### Advanced Business Statistics - 1

(*Descriptive and Mathematical Statistics*)  
(*New Course*)

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.  
(૨) જમણી બાજુએ ગુણ દર્શાવેલ છે.

- ૧ (અ) નિર્દર્શ તપાસનું આયોજન વિસ્તારપૂર્વક સમજાવો. ૧૦  
(બ) નિર્દર્શન એટલે શું ? સરળ યદદ્ય નિર્દર્શન પદ્ધતિ સમજાવો. ૧૦

**અથવા**

- ૧ (અ) આદર્શ પ્રકાશનીના ગુણધર્મો જણાવો. ૧૦  
(બ) ગૌણ માહિતીની એકગીકરણની રીતો સમજાવો. ૧૦

- ૨ (અ) આકૃતિ અને આલેખના લાભાલાભ સમજાવો. ૧૦  
(બ) સમજાવો પાઈ આકૃતિ. ૧૦

**અથવા**

- ૨ નીચેની માહિતી માટે સંભાલેખ, આવૃત્તિ બહુકોણા અને આવૃત્તિ વક્ત દોરો : ૨૦

વર્ગ :	10 – 20	20 – 30	30 – 40	40 – 50	50 – 60	60 – 70	70 – 80	80 – 90
આવૃત્તિ :	2	5	9	12	20	14	5	2

- ૩ (અ) સરેરાશ એટલે શું ? તેના માપો સમજાવો. ૭  
(બ) નીચેની માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો : ૮

વર્ગ :	30 – 32	32 – 34	34 – 36	36 – 38	38 – 40	40 – 42	42 – 44
આવૃત્તિ :	12	18	16	14	12	8	6

**અથવા**

- ૩ (અ) પ્રસારમાન એટલે શું ? આદર્શ પ્રસારમાનના લક્ષણો જણાવો. ૭
- (બ) ૫ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુકૂળે ૩ અને ૧.૪૧ છે. ૮  
ત્રણા અવલોકનો ૧, ૨ અને ૫ હોય તો બાકીના બે અવલોકનો શોધો.
- ૪ વિષમતા એટલે શું ? તેના પ્રકાર સમજાવો. વિષમતાની કસોટીઓ જણાવો. ૧૫  
**અથવા**
- ૪ નીચેની માહિતી પરથી કાર્લ્સ-પિયર્સનની રીતથી વિષમતાંક શોધો : ૧૫

વર્ગ :	૦ – ૧૦	૦ – ૨૦	૦ – ૩૦	૦ – ૪૦	૦ – ૫૦
આવૃત્તિ :	૮	૨૮	૩૯	૬૫	૭૫

## ENGLISH VERSION

### Instructions :

- (1) All questions are compulsory.
- (2) Marks are indicated on the right side.

- 1 (a) Explain in detail the planning of sample survey. 10  
(b) What is sampling ? Explain simple random sampling method. 10

**OR**

- 1 (a) State the properties of an ideal questionnaire. 10  
(b) Explain methods of collection of secondary data. 10

- 2 (a) Explain advantages and disadvantages of diagram and graph. 10  
(b) Explain pie diagram. 10

**OR**

- 2 Construct Histogram, frequency polygon and frequency curve 20  
for the following data :

Class :	10 – 20	20 – 30	30 – 40	40 – 50	50 – 60	60 – 70	70 – 80	80 – 90
Freq. :	2	5	9	12	20	14	5	2

- 3** (a) What is an average ? Explain its measures. **7**  
 (b) From the following data find quartile deviation and coefficient of quartile deviation : **8**

<i>Class</i> :	30 – 32	32 – 34	34 – 36	36 – 38	38 – 40	40 – 42	42 – 44
<i>Freq.</i> :	12	18	16	14	12	8	6

**OR**

- 3** (a) What is dispersion ? State the characteristics of a good measure of dispersion. **7**  
 (b) The mean and standard deviation of five observations are 3 and 1.41 resp. If three observations are 1, 2 and 5 then find remaining two observations. **8**
- 4** What is Skewness ? Explain its types. State the tests of Skewness. **15**

**OR**

- 4** From the following data find the coefficient of Skewness by using Karl Pearson's method : **15**

<i>Class</i> :	0 – 10	0 – 20	0 – 30	0 – 40	0 – 50
<i>Freq.</i> :	8	28	39	65	75